



**NCF-002-002208**      Seat No. \_\_\_\_\_

**M. Com. (Sem. II) (CBCS) Examination**

**April/May – 2017**

**Advanced Statistics : Paper - II**

*(Probability and Probability Distributions)*

*(New Course)*

**Faculty Code : 002**

**Subject Code : 002208**

Time :  $2\frac{1}{2}$  Hours]

[Total Marks : 70]

- સૂચના : (૧) બધા જ પ્રશ્નો ફરજિયાત છે.  
(૨) જમણી બાજુએ પ્રશ્નના ગુણા દર્શાવ્યા છે.  
(૩) કેલક્યુલેટરનો ઉપયોગ કરવાની છૂટ છે.  
(૪) આંકડાશાસ્ત્રીય ટેબલ્સ વિનંતીથી આપવામાં આવશે.

- ૧ (અ) નીચેની માહિતી માટે  $x_3$  નું  $x_2$  અને  $x_1$  પરનું નિયતસંબંધ સમતલ      ૧૦  
સમીકરણ મેળવો. જ્યારે  $x_2 = 52.5$  અને  $x_1 = 58$  હોય ત્યારે  $x_3$ ની  
કિમતનું આગણાન કરો.

$$\begin{array}{lll} \bar{x}_1 = 55.95 & \sigma_1 = 2.26 & r_{12} = 0.578 \\ \bar{x}_2 = 51.48 & \sigma_2 = 4.39 & r_{13} = 0.581 \\ \bar{x}_3 = 56.03 & \sigma_3 = 4.41 & r_{23} = 0.974 \end{array}$$

(બ) સાબિત કરો કે

૧૦

$$(1) \quad \left(1 - r_{12}^2\right) \left(1 - r_{13.2}^2\right) = 1 - R_{1.23}^2$$

$$(2) \quad r_{12.3} = \frac{r_{12} - r_{13}r_{23}}{\sqrt{\left(1 - r_{13}^2\right) \left(1 - r_{23}^2\right)}}$$

અથવા

૧ (અ) યોગ્ય ઉદાહરણો સહિત સંભાવનાના નીચેના નિયમો સમજાવો : ૧૦

- (૧) સરવાળાનો નિયમ
- (૨) ગુણાકારનો નિયમ
- (૩) બેંદજનો નિયમ.

(બ) અસતત યાદચિક ચલ  $x$ નું સંભાવના વિતરણ નીચે પ્રમાણે છે : ૧૦

$x$	-2	-1	0	1	2
$p(x)$	0.15	$p$	$p$	0.15	0.10

(૧) મધ્યક અને પ્રમાણિત વિચલન શોધો.

(૨)  $E(x^3 + 2x + 1)$  અને  $V(3x - 7)$  શોધો.

૨ (અ) ગાણિતિક અપેક્ષાના સરવાળા અને ગુણાકારના નિયમો લખો અને ૧૦  
સાબિત કરો.

(બ)  $n$  અને  $p$  પ્રાયલોવાળા દ્વિપદી વિતરણના મધ્યક અને વિચરણ ૧૦  
શોધો.

અથવા

૨ (અ)  $a, b$  અને  $n$  પ્રાયલોવાળા અતિગુણોત્તર વિતરણના મધ્યક અને વિચરણ મેળવો. ૧૦

(બ) છાણ દ્વિપદી વિતરણના ગુણધર્મો અને ઉપયોગો જણાવો. ૧૦

૩ વિસ્તારની પદ્ધતિનો ઉપયોગ કરીને નીચેની માહિતી માટે પ્રામાણ્ય વિતરણનું અન્વાયોજન કરો અને તેની અપેક્ષિત આવૃત્તિઓ શોધો : ૧૫

વર્ગ - અંતરાલ	11-20	21-30	31-40	41-50	51-60	61-70	71-80
આવૃત્તિ	12	28	40	60	32	20	8

### અથવા

૩ (અ) નીચેની માહિતી માટે પોયસન વિતરણનું અન્વાયોજન કરો અને સૈદ્ધાંતિક આવૃત્તિઓ શોધો : ૮

$x$	0	1	2	3	4	5
$f$	40	30	20	15	10	5

(બ) ગુણોત્તર વિતરણના મધ્યક અને વિચરણ શોધો અને બતાવો કે મધ્યક  $<$  વિચરણ છે. ૭

૪ (અ) નીચેના પદો ટૂકમાં સમજાવો : ૮

(૧) પરસ્પર નિવારક ઘટનાઓ

(૨) સ્વતંત્ર ઘટનાઓ

(૩) શરતી સંભાવના

(૪) નિઃશેખ ઘટનાઓ.

(બ)  $p$  પ્રાચ્યલવાળા ગેમા-વિતરણનું પ્રધાતસર્જક વિધેય મેળવો અને તે પરથી ૭  
તેના મધ્યક અને વિચરણ શોધો.

### અથવા

૪ (અ) (૧) અવશિષ્ટો (૨) બહુચલીય સહસંબંધાંકો (૩) આંશિક સહસંબંધાંકોના ૧૦  
ગુણાધમ્રો જણાવો.

(બ) બીટા ટાઈપ-1 અને બીટા ટાઈપ-2 વિતરણો વિશે ટૂકનોંધ લખો. ૫

## ENGLISH VERSION

### Instructions :

- (1) All questions are compulsory.
- (2) Marks are indicated on the right side.
- (3) You are allowed to use calculator.
- (4) Statistical tables will be given on request.

1 (ા) For the following data, obtain the plane of regression 10  
equation of  $x_3$  on  $x_2$  and  $x_1$ . Estimate the value of  
 $x_3$  when  $x_2 = 52.5$  and  $x_1 = 58$  :

$$\begin{array}{lll} \bar{x}_1 = 55.95 & \sigma_1 = 2.26 & r_{12} = 0.578 \\ \bar{x}_2 = 51.48 & \sigma_2 = 4.39 & r_{13} = 0.581 \\ \bar{x}_3 = 56.03 & \sigma_3 = 4.41 & r_{23} = 0.974 \end{array}$$

(b) Prove that :

10

$$(1) \quad (1 - r_{12}^2) (1 - r_{13.2}^2) = 1 - R_{1.23}^2$$

$$(2) \quad r_{12.3} = \frac{r_{12} - r_{13}r_{23}}{\sqrt{(1 - r_{13}^2)(1 - r_{23}^2)}}$$

**OR**

1 (a) Explain the following rules of probability with suitable illustrations : 10

(1) Addition rule

(2) Multiplication rule

(3) Baye's rule.

(b) A discrete r.v.  $x$  has the following probability distribution : 10

$x$	-2	-1	0	1	2
$p(x)$	0.15	$p$	$p$	0.15	0.10

Find : (1) Mean and Standard deviation.

$$(2) \quad E(x^3 + 2x + 1) \text{ and } V(3x - 7).$$

2 (a) State and prove addition and multiplication rule of mathematical expectation. 10

(b) Find mean and variance of binomial distribution with parameters  $n$  and  $p$ . 10

**OR**

- 2** (a) Obtain mean and variance of hypergeometric distribution **10**  
 with parameters  $a$ ,  $b$  and  $n$ .
- (b) State properties and uses of negative binomial distribution. **10**
- 3** Fit normal distribution by using area method to the following **15**  
 data and calculate expected frequencies :

<i>Class-Interval</i>	11–20	21–30	31–40	41–50	51–60	61–70	71–80
<i>Frequency</i>	12	28	40	60	32	20	8

### **OR**

- 3** (a) Fit Poisson distribution to the following data and calculate **8**  
 theoretical frequencies :
- |     |    |    |    |    |    |   |
|-----|----|----|----|----|----|---|
| $x$ | 0  | 1  | 2  | 3  | 4  | 5 |
| $f$ | 40 | 30 | 20 | 15 | 10 | 5 |
- (b) Find mean and variance of geometric distribution and **7**  
 show that mean  $<$  variance.
- 4** (a) Explain the following terms in brief : **8**
- (1) Mutually Exclusive Events
  - (2) Independent Events
  - (3) Conditional Probability
  - (4) Exhaustive Events.

- (b) Obtain moment generating function of gamma distribution      7  
with parameter and hence find its mean and variance.

**OR**

- 4     (a) State properties of (1) residuals (2) multiple correlation      10  
coefficients (3) partial correlation coefficients.
- (b) Write short note on Beta type-I and II distributions.      5
-